



જાગૃતિ સંદેશ

JAGRUTI SANDESH

RNI No. 66215/96 Vol. 25 Issue: 9 Mumbai SEPTEMBER 2021 Pages: 24 Price: ₹ 5

પરસ્પર પરિચય અને પ્રેમથી પાંગરતી પરિવાર



“મિશ્રામિ
દુક્કડમ્”





જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ

જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

અમારાં હૃદયમાં જેમનું સ્થાન અદકેરૂં છે, એ સમસ્ત જેજેસી પરિવારજનોને ત્રિવિધે ત્રિવિધે

“મિચ્છામિ દુક્કડમ્”

સર્વે આરાધક તપસ્વીઓની અંતઃકરણપૂર્વક “અનુમોદના”



શ્રી પ્રકુલ્લ વી. કામદાર

જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ - ચેરમેન

શ્રી પ્રકુલ્લ વી. કામદાર - ચેરમેન

તા.ભૂ.પૂ.ચેરમેન
શ્રી સંજય બી. શાહ
વાઈસ ચેરમેન
શ્રી કિશોર એસ. શેઠ
શ્રી વિનોદ એ. જૈન
સેક્રેટરી જનરલ
શ્રી જયંતીભાઈ કે. છાડવા
સેક્રેટરી
શ્રી ઉદય ડી. સંઘવી
શ્રી અનિલ જી. દોશી
શ્રી મીતેષ એમ. અંબાવી
શ્રી ભાવિન જે શાહ

ડેવલપમેન્ટ સેક્રેટરી
શ્રી રાજેશ સી. ગાંધી
ખજાનચી
શ્રી રાજેશ આર. ભણસાલી
શ્રી પ્રકુલ પી મહેતા
માનદૂ તંત્રી
શ્રી ચંદ્રકાંત એફ. શાહ

જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ



શ્રી જિતેન્દ્ર એસ. કોઠારી

જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ
ચેરમેન

શ્રી જિતેન્દ્ર એસ. કોઠારી - ચેરમેન

તા.ભૂ.પૂ.ચેરમેન/અનુદાન ટ્રસ્ટી
શ્રી કિશોર એન. શાહ
વાઈસ ચેરમેન / ટ્રસ્ટી
શ્રી રમેશ જે. મોરબિયા
વાઈસ ચેરમેન / કાયમી ટ્રસ્ટી
શ્રી સંજય બી. શાહ
સેક્રેટરી / કાયમી ટ્રસ્ટી
શ્રી પ્રકુલ્લ વી. કામદાર
સેક્રેટરી / ટ્રસ્ટી
શ્રી અમિત ડી. કોઠારી
ખજાનચી / ટ્રસ્ટી
શ્રી હસમુખ કે. દેઢિયા
(અનુદાન ટ્રસ્ટી)
શ્રી પ્રવીણ જી. શાહ,
શ્રી કમલેશ સી. શાહ
કાયમી ટ્રસ્ટી
શ્રી હર્ષદ જે. ગાંધી
શ્રી અનિલ જી. દોશી

શ્રી રાજેશ સી. ગાંધી
શ્રી રાજેશ આર. ભણસાલી
(ટ્રસ્ટી)
શ્રી કિશોર એસ. શેઠ
શ્રી શૈલેષ ડી. શાહ
શ્રી જયંતી કે. છાડવા
શ્રી ધર્મેશ એસ. જૈન
શ્રી ચંદ્રકાંત એફ. શાહ
આમંત્રિત
શ્રી દિનેશ વ્હી. શાહ
શ્રી કિરણ એચ. શાહ
શ્રી રસિક એન. કોઠારી
શ્રી ઉદય ડી. સંઘવી
શ્રી કીર્તિ કે. શાહ
શ્રી મુકેશ સી. શાહ
શ્રી મહેંદ્ર પી. શાહ
શ્રી રમેશ જી. લાખાણી



જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ

ક્રમિકેટ ક્રમિકેટી ૨૦૨૦-૨૦૨૧

◆ ચેરમેન ◆

શ્રી પ્રકુલ્લ વી. કામદાર

◆ તા.ભૂ.પૂ.ચેરમેન ◆

શ્રી સંજય બી. શાહ

◆ વાઈસ ચેરમેન ◆

શ્રી કિશોર એસ. શેઠ

શ્રી વિનોદ એ. જૈન

◆ સેક્રેટરી જનરલ ◆

શ્રી જયંતીભાઈ કે. છાડવા

◆ સેક્રેટરી ◆

શ્રી ઉદય ડી. સંઘવી

શ્રી અનિલ જી. દોશી

શ્રી મીતેષ એમ. અંબાવી

શ્રી ભાવિન જે શાહ

◆ ડેવલપમેન્ટ સેક્રેટરી ◆

શ્રી રાજેશ સી. ગાંધી

◆ ખજાનચી ◆

શ્રી રાજેશ આર. ભાણસાલી

શ્રી પ્રકુલ પી મહેતા

◆ માનદ્ તંત્રી ◆

શ્રી ચંદ્રકાંત એફ. શાહ

૨૦૧, માથાડુ આર્કેડ, સુભાષ રોડ,
ગરવારે પોલિસ્ટરની નજીક, એક્સિસ
બેન્કની ઉપર વિલેપાર્તા (પૂર્વ),
મુંબઈ-૫૭.

ફોન: ૦૨૨-૬૬૯૭૩૦૩૮/
૦૨૨-૬૬૯૫૬૬૯૯

Website : www.jainjagruti.com

E-mail : admin@jainjagruti.com

editor@jainjagruti.com

પત્રિકામાં પ્રગટ થતા લેખો કે
વિચારો લેખકના અંગત છે. તેની
સાથે સંસ્થા કે તંત્રી સહમત છે
એમ માની લેવું નહીં.
કાનૂની કાર્યવાહીનું અધિકાર ક્ષેત્ર
મુંબઈ રહેશે.

છૂટક મૂલ્ય રૂ.૫/-

વાર્ષિક લવાજમ રૂ.૫૦/-



જેજેસી-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

ચેરમેન / કાયમી ટ્રસ્ટી

શ્રી જિતેન્દ્ર એસ. કોઠારી

તા.ભૂ.પૂ.ચેરમેન/અનુદાન ટ્રસ્ટી

શ્રી કિશોર એન. શાહ

વાઈસ ચેરમેન / ટ્રસ્ટી

શ્રી રમેશ જે. મોરબિયા

વાઈસ ચેરમેન / કાયમી ટ્રસ્ટી

શ્રી સંજય બી. શાહ

સેક્રેટરી / કાયમી ટ્રસ્ટી

શ્રી પ્રકુલ્લ વી. કામદાર

સેક્રેટરી / ટ્રસ્ટી

શ્રી અમિત ડી. કોઠારી

ખજાનચી / ટ્રસ્ટી

શ્રી હસમુખ કે. દેઢિયા

(અનુદાન ટ્રસ્ટી)

શ્રી પ્રવીણ જી. શાહ,

શ્રી કમલેશ સી. શાહ

કાયમી ટ્રસ્ટી

શ્રી હર્ષદ જે. ગાંધી

શ્રી અનિલ જી. દોશી

શ્રી રાજેશ સી. ગાંધી

શ્રી રાજેશ આર. ભાણસાલી

(ટ્રસ્ટી)

શ્રી કિશોર એસ. શેઠ

શ્રી શૈલેષ ડી. શાહ

શ્રી જયંતી કે. છાડવા

શ્રી ધર્મેશ એસ. જૈન

શ્રી ચંદ્રકાંત એફ. શાહ

આમંત્રિત

શ્રી દિનેશ વ્હી. શાહ

શ્રી કિરણ એચ. શાહ

શ્રી રસિક એન. કોઠારી

શ્રી ઉદય ડી. સંઘવી

શ્રી કીર્તિ કે. શાહ

શ્રી મુકેશ સી. શાહ

શ્રી મહેંદ્ર પી. શાહ

શ્રી રમેશ જી. ભાખાણી



Message From
The
CHAIRMAN.....



હાલા સભ્ય સ્વજનો,

સહુ પ્રથમ તો આપ

સહુને પવિત્ર પર્યુષણ પર્વના

સમાપન પછી મિચ્છામિ

દુકકડમ ! જૈન ધર્મ માનવીને જીવન જીવવા માટે અદભૂત
સંદેશ આપે છે અને તે છે ક્ષમાપનાનો...માનવ સહજ
સ્વભાવને કારણે, રોજબરોજના વ્યવહારને કારણે કે
ક્યારેક સંજોગોવશાત આપણાથી એવું બની શકે કે જેને
કારણે સામેવાળી વ્યક્તિની લાગણી દુભાય કે તેમને અન્યાય
થા. ક્યારેક એવું પણ બને કે આપણી ભૂલ કે ઈચ્છા ન હોય
તો પણ સમજફેર કે ગેરસમજણને કારણે આપણા
સ્વજનોને દુઃખ થાય કે તેમની લાગણી દુભાઈ હોય. આવા
સમયે એક અકિસર ઔષધ સમાન જો કંઈ હોય તો તે છે,
ક્ષમાપના !

ક્ષમા માંગવી પણ અઘરી છે અને ક્ષમા આપવી
પણ એટલી જ અઘરી છે. પરંતુ જો આપણને એ હસ્તગત
થઈ જાય તો જીવનમાં શાતાના અમીઝરણાં વરસવા માંડે.
જ્યારે આપણે માફી માંગીએ છીએ ત્યારે સાચાં અર્થમાં
પ્રતિક્રમણ કરીએ છીએ અને માફી આપીએ છીએ ત્યારે
પણ સાચાં અર્થમાં સામાયિક કરતાં હોઈએ છીએ. જૈન ધર્મ
તો સમસ્ત વિશ્વમાં વિચરતા જીવો પ્રત્યે કરૂણા દર્શાવવાની
અને સ્નેહ વરસાવવાની વાત કરે છે અને જાણતા કે
અજાણતા જો કોઈને હાની પહોંચી હોય તો એ દરેક જીવને
ખમાવવાનો સંદેશો આપે છે. આપણે સહુ નસીબવાન છીએ
કે આપણે જૈન ખોળિયામાં જન્મ લીધો છે.

ભગવાન મહાવીરના જીવનમાં તો એવા પ્રસંગો
આવ્યાં કે જ્યારે તેમનો કંઈપણ વાંક કે ગુનો ન હોવા છતાં
લોકોએ તેમને સંતાપ આપ્યો હતો પરંતુ તેમ છતાં સહુકોઈને
સમતાભાવે નિહાળનારા પ્રભુ મહાવીર તો સહુકોઈ ઉપર
માત્ર કરૂણા જ વરસાતાં રહ્યાં.

શ્રાવણ-ભાદરવાના સરવરિયા જ્યારે વરસતાં

હોય અને ધર્મની ધજા ફરકતી હોય ત્યારે પવિત્ર પર્યુષણ મહિનામાં અનેક લોકોએ પોતપોતાની સમજણ અને કર્મના ઉદયને અનુરૂપ તપ-ઉપવાસ કરીને આત્માની ઉન્નતિનો માર્ગ અપનાવ્યો હશે. ગુરૂભગવંતોની નિશ્રામાં, તેમના આશીર્વાદથી વિવિધ પ્રકારની તપસ્યાઓ પાર પડી શકી હશે. જેજેસીના વિશાળ પરિવારના એ દરેક તપસ્વીઓની કોટિ કોટિ અનુમોદના કરીએ છીએ. આ ભવમા કરેલ સત્કર્મ જ આપણે માટે મોક્ષનો માર્ગ સરળ કરશે. પર્યુષણ અવસરે સાધુ-ભગવંતોની ધર્મમય વાણીનો લાભ પણ આપણે મેળવ્યો.

જેમ ગણેશજીની પદરામણી થાય અને શુભ કાર્યોનો આરંભ થાય એમ આપણે સહુકોઈ પણ હવે કોરોનાને વિસારીને શિક્ષણ, નોકરી કે વેપાર ક્ષેત્રે નવા જોમથી આગળ વધવાનો આરંભ કરવાનો છે. જેમ આ પૃથ્વી ઉપર દશ દિવસ ધરતી ઉપર રહેવાથી જે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું એ ગણપતિ બાપ્પાની મનોરમ મૂર્તિઓનું વિસર્જન કરીએ છીએ એ જ રીતે આપણી અંદર રહેલાં ક્ષાયોનું પણ વિસર્જન કરવાનો પ્રયાસ કરીએ !

ઓક્ટોબર મહિનામાં બીજી તારીખે આપણા રાષ્ટ્રના પિતામહ સમાન મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે અને એ જ દિવસે અન્ય એક મહાનુભાવ કે જેઓએ સન ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશનું નેતૃત્વ કર્યું હતું એ લાલબહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મ દિવસ આવે છે. અત્યંત ગરીબીમાં ઉછરેલાં લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન, જય કિસાન’ નું સૂત્ર દેશવાસીઓને આપ્યું હતું તો મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશો આપ્યો હતો.

હવે એક પછી એક તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જશે. સનાતન ધર્મની રૂઢિ મુજબ શ્રાદ્ધપક્ષના દિવસો પછી વર્ષનો અંતિમ મહિનો એટલે કે આસો માસનો આરંભ અંબામાતાની પદરામણીથી થશે. આસ્થા અને ઉમંગનો ઉત્સવ એટલે ‘નવરાત્રી’ ! હાલમાં વ્યાપ્ત કોરોના સંક્રમણ સમયમાં આપણે આ ઉત્સવની ઉજવણી મર્યાદામાં રહીને કરવી પડશે. મા અંબાને પૂજતાં અને ભજતાં પ્રાર્થના કરીએ કે આ દેશની પવિત્ર ધરતી પરથી હવે કોરોના સંકટને સંપૂર્ણપણે

દૂર કરીને સહુકોઈને અભયદાન આપો. શરીર તંદુરસ્ત અને મન સ્વસ્થ રહે એવા આશીર્વાદ આપો. અસત્ય પર સત્યના વિજયનો મહિમા દર્શાવતો તહેવાર એટલે કે ‘દશેરા ‘કોરોના સંક્રમણ’ પર વિજયી બનીને વિશ્વને નિરોગી બનાવીને પ્રગતિપંથે આગળ ધપાવે એવી ભાવના વ્યક્ત કરીએ. આગામી દિપોત્સવ સાચાં અર્થમાં સહુકોઈના જીવનમાં ઉજાસ પાથરે એવી પ્રભુ ચરણે પ્રાર્થના કરીએ !

હવે, વાત કરીએ આપણા સેન્ટર્સના બહોળા પરિવારજનોને ઉપયોગી થઈ શકે એવી સરકારી યોજનાની ! જે પરિવારોમાં બાળકો અભ્યાસ કરે છે તેઓ માટે સરકારે જાહેર કરેલી સ્કોલરશીપ યોજનાનો લાભ વધુમાં વધુ પરિવારોને મળી શકે એ હેતુથી વિવિધ સેન્ટરની કારોબારીએ પ્રચાર અને પ્રસારનું કામ ખૂબ સારી રીતે કર્યું છે. જેજેસીના કારોબારી સભ્યોએ ખાસ ‘હેલ્પડેસ્ક’ની રચના કરી છે જેનો લાભ વિદ્યાર્થીઓ લઈ રહ્યાં છે.

ઓક્ટોબર મહિનાના આરંભે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે અને એમણે પણ જૈન ધમના સર્વોપરિ સિદ્ધાંત એવા અહિંસાના માર્ગને પ્રશસ્ત કર્યો હતો. અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય જેવા સિદ્ધાંતો જીવનને સાથક કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સમતાભાવ અને સહિષ્ણુતા થકી વિશ્વશાંતિ સહજ પ્રાપ્ત થાય છે.

આજે આપણું રાષ્ટ્ર પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે સહુકોઈએ જવાબદાર નાગરિક તરીકેની આપણી ફરજ પણ નિષ્ઠાપૂર્વક નિભાવવાની આવશ્યકતા છે. માત્ર સ્વકેન્દ્રી બનીને જીવવાથી તો લાંબે ગાળે આપણી ભાવી પેઢી માટે આપણે સમસ્યાઓનો ખડકલો જ કરી શકીએ ! રાષ્ટ્ર મજબૂત અને સુરક્ષિત હશે તો આપણા ધર્મની સુરક્ષા પણ સહજરીતે થઈ શકશે.

અંતમાં સહુકોઈને ફરીથી મિચ્છામિ દુકકડમ ! ચાલો જેજેસી સંગઠનને શ્રેષ્ઠ બનાવીએ !

જય જીનેન્દ્ર

લિ. પ્રફુલ વી. કામદાર

ચેરમેન: જે. જે. સી. - સેન્ટ્રલ બોર્ડ

જાગૃતિ સંદેશ

જૈન જાગૃતિ સેન્ટર તથા જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા નીચેનાં પદાધિકારી તથા સર્વે સેન્ટરોના સેન્ટ્રલ બોર્ડના જન્મદિવસ નિમિત્તે ચેરમેન હાર્દિક શુભેચ્છા પાઠવે છે

OCTOBER CHARTER DATE						
Sr. No.	Name Of Centre	Charter Date	President	Mobile No	Secretary	Mobile No.
1	Badnawar	04-10-2015	Ashok Sanghvi	9981977001	Arun Sundecha	9424075822
2	Una	08-10-2000	Ravindra Doshi	9825597927	Mahendra Shah	9426850992
3	Ladies Wing Dhoraji	08-10-2017	Viral Parekh	9429168095	Jemi Shah	9662287406
4	Ladies Wing Wankaner	08-10-2017	Geeta Belani	9409411429	Jayshree Solani	9409405715
5	Dhoraji	10-10-2010	Lalit Vora	9913975566	Tejas Mehta	9879278387
6	Udhna	13-10-2013	Jayantilal Kukra	9825135744	Rakesh Dangi	9427106327
7	Dhrangadhra	22-10-2000	Vastupal Gandhi	9427376698	Sanjeev Champaneri	9427373299
8	Pink Pant Nagar	25-10-1988	Satish Mehta	8898022215	Deepesh Mehta	9819333748

શ્રદ્ધાંજલિ



જયેન્દ્રભાઈ દડિયા - ઘાટકોપર

અરિહંત શરણ : તા. ૯.૯.૨૦૨૧

આપની મધુર સ્મૃતિઓ, આપની નિર્મળ નિખાલસતા તમારી ધર્મભક્તિને નમસ્કાર
જીવન એવું જીવી ગયા કે કદી ભુલાય નહી
વિદાય એવી લીધે કે કદી ભુલાય નહી
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે પ્રાર્થના



જેજેસી પરિવારના કર્મઠ અને સમર્પિત સ્વજની દુઃખદ વિદાય!



સમસ્ત જેજેસી પરિવાર ભાવાંજલિ અર્પણ કરે છે.

જીતેન્દ્ર એસ. કોઠારી

ચેરમેન

જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

પ્રફુલ વી. કામદાર

ચેરમેન

જેજેસી સેન્ટ્રલ બોર્ડ

લાંબા અંતરની યાત્રા સમયે નાસ્તા-ભોજન બાબતે

જાગૃત બનીયે... સાવચેત રહીએ...

એક જાણીતી કહેવાત છે,

“અન્ન તેવા ઓડકાર...”

બીજી કહેવાત છે, “અન્ન તેવું મન...”

આજના આધુનિક યુગમાં, ગતિશીલ જીવનશૈલી, લગભગ દરેક પરિવારનું અભિન્ન અંગ બની ગઈ છે. મુસાફરી દરમિયાન અગાઉના સમયમાં મોટાભાગે ઘરમાં બનેલાં નાસ્તા-ભોજન સાથે લઈને જતાં... પરંતુ હવે તૈયાર ‘ફુડ પેકેટ્સ’નું ચલણ વધી ગયું છે. હા, એ વાત પણ માનવી પડે કે આપણે હજુ ખાખરા-થેપલા-અથાણાં અને ગાંઠિયાને છોડ્યાં નથી! પરંતુ, હવે અનેક લોકો, ખાસ કરીને યુવાન પેઢીને યાત્રા કે મુસાફરી સમયે બહારનું એટલે કે હોટેલનું કે પેકડ ફુડ-તૈયાર ખાવાનું ઓર્ડર કરવાનું વધું પસંદ આવે છે. આપણે ગમે તેટલાં આધુનિક બની જઈએ પરંતુ આપણા ધર્મ અને સંસ્કારને જો જાળવી રાખીએ તો જરૂર આપણું માનસિક અને શારીરિક સ્વસ્થ્ય જાળવાઈ રહેશે.

ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી ઘરનું બનેલું ભોજન જ

ગ્રહણ કરીએ એ ઈચ્છનીય છે. સાથે પરમોસ વસાવી લઈને ચા-કોફી કે દૂધ પણ લઈ જઈએ અને ફેરિયાઓ પાસેથી ન લઈએ એ ઈચ્છનીય છે.

સોશ્યલ મિડિયા પર આપણે અવરનવર જોઈએ છીએ કે ટ્રેનના શૌચાલયમાંથી પાણી ભરીને ચા-કોફી તૈયાર કરવામાં આવે છે.

તદઉપરાંત દૂધની ગુણવત્તા પણ કેવી હોય એની આપણને જાણ નથી હોતી. અગાઉના સમયમાં તો પ્રવાસ દરમિયાન પીવાનું ઉકાળેલું પાણી પણ ઘરેથી માટીના કુંજામાં લઈ જવાનું ચલણ હતું. હવે, આજે આપણે ‘મિનરલ વોટર’ને નામે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું "Packed Filtered Water" ખરીદીએ છીએ. પરંતુ, એમાં પણ ઘણીવાર અસુરક્ષિત રીતે જુની બોટલમાં ગમે તે સ્થાનેથી ભરીને વેચાતું પાણી પણ હોઈ શકે એ વાત ઘણાં લોકો સમજી નથી શકતાં.

બીજી તરફ, જ્યારે by Road એટલે કે વાહન દ્વારા લાંબી મુસાફરી કરતી વખતે હાયવેને અડીને આવેલ હોટેલ્સ પર સહેજ આરામ કરવા કે ચા-નાસ્તો-ભોજન કરવા અટકવાનું સામાન્ય ચલણ છે. દરેક હોટેલમાં ચોખ્ખાઈ હોય જ એ જરૂરી નથી. વળી, અમૂક હોટેલમાં કિચનમાં કામ કરતાં કર્મચારીઓ શાકાહારી જ હોય એવું જરૂરી નથી. કદાચ એવું પણ બનતું હોઈ શકે કે ગ્રાહકો માટે શાકાહારી ભોજન પિરસાતું હોય પરંતુ પોતાને માટે તેમને મનગમતું ભોજન તેઓ બનાવતા હોય.



આપણે જેન પરિવારોએ તો લાંબી મુસાફરી દરમ્યાન શક્યતઃ ઘરેથી જ સાત્વિક વ્યંજનો લઈને મુસાફરી કરવી જોઈએ અથવા તો માર્ગમાં આવતા જેન ઉપાશ્રય કે દેરાસરની ભોજનશાળામાં જ અલ્પ રોકાણ માટે જવું જોઈએ.

વાંચકોને નમ્ર વિનંતી કે આપ વિવિધ હાઈવે દ્વારા મુસાફરી વખતે જો આવા કોઈ સાત્વિક ભોજન ઉપલબ્ધ હોય એવી હોટેલ્સ કે

ભોજનશાળા બાબતે માહિતી ધરાવતા હો તો, જરૂર અમને મોકલજો.

આગામી અંકોમાં આપણાં જેન પરિવારોના લાભાર્થે આવા સ્થાનોની માહિતી રજુ કરીશું.

રાત્રી રોકાણ અને અલ્પ સમયના ઉતારા માટે પણ સુચારૂ સ્થાનની માહિતી પ્રસ્તુત કરીશું.

તો, હવેથી નક્કી જ કરી લઈએ કે “સાત્વિક અન્ન... સાત્વિક મન...! માટે ઘરનું જ ભોજન!

GREAT SENTENCES

- 1) Prayer is not a "spare wheel" that you pull out when in trouble, but it is a "steering wheel" that directs the right path throughout.
- 2) Do you know why a Car's WINDSHIELD is so large & the Rear view Mirror is so small?
Because our PAST is not as important as our FUTURE.
Look Ahead and Move on.
- 3) Friendship is like a BOOK. It takes few seconds to burn, but it takes years to write.
- 4) All things in life are temporary. If going well, enjoy it, they will not last forever. If going wrong, don't worry, they can't last long either.
- 5) Old Friends are Gold! New Friends are Diamond! If you get a Diamond, don't forget the Gold! Because to hold a Diamond, you always need a Base of Gold!
- 6) Often when we lose hope and think this is the end, GOD smiles from above and says, "Relax, sweetheart, it's just a bend an U turn, not the end!
- 7) When GOD solves your problems, you have faith in HIS abilities; when GOD doesn't solve your problems HE has faith in your abilities.
- 8) A blind person asked Swami Vivekanand: "Can there be anything worse than losing eye sight?"
He replied: "yes, losing your vision!"
(vision=આંતરદૃષ્ટિ)
- 9) When you pray for others, God listens to you and blesses them, and sometimes, when you are safe and happy, remember that someone has prayed for you.
- 10) WORRYING does not take away tomorrows' TROUBLES, it takes away today's; PEACE
- 11) Best Prayer-Let Thy will be done. (તારી ઈચ્છા પ્રમાણે થાઓ.)
- 12) Always count innumerable blessings God has showered upon us.
- 13) Thank God at least 100 times a day - Einstein.

સફળતાની સફર ઓલા (OLA)

વિશ્વ જ્યારે વિકાસ તરફ ગતિ કરતું હોય, નીત નવી ટેકનોલોજી અને ટેકનિક્સના આવિષ્કાર થતાં હોય, એ બદલાતાં યુગમાં એક મહત્વાકાંક્ષી યુવક કેવો ચમત્કાર સર્જી શકે છે એ જાણવું હોય તો કોરોના સંક્રમણ થકી ઉદ્ભવેલી પરિસ્થિતિને દોષ દેવાને બદલે નવી ચેતના સાથે સતત વિચારશીલ બનીને કાર્યરત રહેવાની મનોદશા કેળવવી જોઈએ “પરિશ્રમનો કોઈ પર્યાય નથી અને નિરાશાવાદીને માટે કોઈ ધ્યેય કે મંજિલ નથી...” એ દિવા જેવી ચોક્ખી વાત સમજી લેવી જોઈશે.

અ | પ | ઇ | રોજબરોજની દિનારાત્રીમાં અનુભવીએ છીએ કે ક્યાંક પાહોંરાવાની

ઉતાવળ હોય ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ, રિક્ષા, ટેક્સી કે ટ્રેન આ પર્યાયોમાંથી કોઈપણ પસંદ કરવો પડે છે. હા, જેમના પોતાના વાહન હોય તેઓ એનો ઉપયોગ કરી શકે પરંતુ એમને પાર્કિંગનો તથા ટ્રાફિકની સમસ્યાનો અનુભવ કરવો જ પડે.

એવું પણ બનતું આવે છે કે તમે હાથથી ઈશારો કરીને રિક્ષા કે ટેક્સીને રોકો તો એનો ચાલક પહેલાં તમને પૂછે કે તમારે ક્યાં

જવું છે? અથવા તમારે તમારાં ગંતવ્ય સ્થાને એ આવશે કે કેમ? એ પૂછવું પડે છે, ઈન શોર્ટ, શહેરી જીવનમાં આ બધી સમસ્યાઓને કારણે અનેકવાર વ્યગ્રતાનો અનુભવ કરવો પડતો હોય છે. વળી, એવું પણ ઘણીવાર બને છે કે આપણે કોઈ સ્થળે જવું હોય પણ એ વિસ્તારથી આપણે પરિચિત ન હોઈએ તો અહિં-તહીં પૂછતાં પૂછતાં થાકી જવાય અને એને કારણે આપણી મુસાફરી મુંઝવણભરી અને ત્રાસદાયક બની જતી હોય છે.



જેઓ અંગત વાહનનો ઉપયોગ કરવાનું ટાળવા ઈચ્છતાં હોય તેવા લોકો વિવિધ પ્રકારની સમસ્યાઓ મહદ્ અંશે ઓછી કરી શકે એવી ટેક્સી

સેવા ભારતમાં જે પ્રથમવાર લાવ્યાં છે એ વ્યક્તિનું નામ છે. ભાવિશ અગરવાલ.

ભારતની સર્વપ્રથમ અને આજે લોકપ્રિય ટેક્સી સેવા “ઓલા”ના સંસ્થાપન અને ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ભાવિશ અગરવાલે ૨૦ વર્ષની યુવા વયે 'OLA CABS'ની શરૂઆત ૩ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ કરી હતી. IIT મુંબઈના વર્ષ ૨૦૦૮ના સ્નાતક ભાવિશ અગરવાલ અને અંકિત ભાટી એ સહિયારું

સ્વપ્ન સેવ્યું. ‘ઓલા કેબ્સ સર્વિસ’ને શરૂ કરવાનું અને એ દિશામાં આ બંને યુવાનોએ ઊંડાણપૂર્વક અભ્યાસ અને સંશોધન કરીને OLA એપ્લિકેશન તૈયાર કરાવડાવી. ‘ઓલા’ એક ઓનલાઇન એપ્લિકેશન (Online App) છે કે જે મુખ્યત્વે ટેક્સી સેવા માટે માત્ર ભારતભરમાં જ નહીં, હવે તો વિદેશમાં પણ જાણીતું નામ થઈ ગયું છે. આ ક્ષેત્રમાં અન્ય ઓપરેટર્સ ‘મેરુ (Meru) અને ઉબર (Uber)ની સાથે સ્પર્ધામાં આજે ઓલા (OLA) ખૂબજ ઉત્તમ રીતે સફળતાની દિશામાં આગળ વધી રહેલ કંપની છે.

ઓલા કેબ્સના સ્થાપક ભાવિશ અગરવાલનો જન્મ તા. ૨૮ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ પંજાબના લુધિયાણા ખાતે થયો. પિતા નરેશકુમાર અગરવાલ અને માતા ઊષા અગરવાલનો પુત્ર મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થયો. મધ્યમ વર્ગના પરિવારમાં ઉછરેલાં ભાવિશ અભ્યાસ બાદ “માઈક્રોસોફ્ટ રિસર્ચ ઈન્ડિયા”માં બે વર્ષ કાર્યરત રહ્યો એ દરમિયાન એકવાર બેંગલોરથી



બંદિપુરના પ્રવાસ માટે ટેક્સી ચાલક સાથે તેને અનિચ્છનીય અનુભવ થયો. પ્રવાસ દરમિયાન અધવચ્ચે જ ટેક્સી ચાલકે વાહન ઉભુ રાખી દઈને પ્રવાસ ખર્ચ બાબતે રકઝક કરી અને વધારે ભાડું માગ્યું અને અધવચ્ચે જ એણે અટવાઈ જવું પડ્યું. આ અનુભવને કારણે તેના સંશોધક મગજમાં ચમકારો થયો. ત્યારબાદ થોડા જ સમયગાળા બાદ તેણે માઈક્રોસોફ્ટમાં

રાજીનામું આપ્યું અને “ઓનલાઇન કંપની” શરૂ કરી આ ઓનલાઇન કંપનીના પોર્ટલ Olatrip.com દ્વારા રજાઓમાં પર્યટન તથા અલ્પકાલિન પ્રવાસના આયોજન બાબતનો વ્યવસાય શરૂ થયો. ભાવિશે તેના IIT સહપાઠી અંકિત ભાટી સાથે પોતાના ટેક્સીચાલક સાથેના અનુભવ બાદ ઓનલાઇન ટેક્સી સેવાની વ્યવસ્થા બાબતે ચર્ચા કરી.

OLA CABS ઈન્ટરનેટના માધ્યમથી પ્રવાસીઓ તથા ટેક્સીચાલકો વચ્ચે સંપર્ક સેતુ માધ્યમ બની ગયું. સહુપ્રથમ આ વ્યવસ્થાનો પ્રારંભ મુંબઈમાં થયો.

હાલમાં બેંગલોર ખાતે ‘ઓલા કેબ્સ’ની મુખ્ય ઓફિસ છે પરંતુ શરૂઆતમાં તેઓ મુંબઈથી સંચાલન કરતાં હતાં. તા. ૩ ડિસેમ્બર, ૨૦૧૦માં

OLA CABS સેવાનો આરંભ કોઈપણ પ્રકારની મોટી મૂડી રોકાણ વગર એક “સ્ટાર્ટઅપ કંપની” તરીકે થયો અને આ સેવાને જે સફળતા મળી છે એ ચમત્કારિક છે. અકલ્પનીય છે!

શરૂઆતના તબક્કે આ “સ્ટાર્ટઅપ વેન્યર” તકલિફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ

સમયાંતરે એક પછી એક મુશ્કેલીઓને માત આપતાં આપતાં “ઓલા કેબ્સ” વિદેશમાં પણ પોતાનો વ્યાપ વધારતી ગઈ.

OLA આજે ભારતમાં ૨૨ જેટલાં શહેરોમાં પોતાની સેવા આપીને અટળક કમાણી કરે છે અને વિદેશમાં સહુપ્રથમ ઓસ્ટ્રેલિયા ખાતે જાન્યુઆરી, ૨૦૧૮માં તથા સાપ્ટેમ્બર ૨૦૧૮માં ન્યુઝિલેન્ડ ખાતે તથા માર્ચ ૨૦૧૯માં યુનાયટેડ કિંગડમ (UK) ખાતે પોતાનો વ્યાપ વધાર્યો અને સફળ પણ થયાં.

હાલમાં ઓલાની કમાણી આશરે બે હજાર પાંચસો કરોડ પ્રતિવર્ષની હોવાનો અંદાજ છે કે જે સતત કુદકે ને ભુસકે વધી રહી છે.

હાલમાં જ ઓલા દ્વારા તામિલનાડુ ખાતે

રૂપિયા ૨૪૦૦ કરોડના રોકાણથી નવા ઇલેક્ટ્રીક સ્કુટર (દુ વ્હીલર)નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે આશરે વીસ લાખ ઇલેક્ટ્રીક સ્કુટર્સનું ઉત્પાદન કરવાની નેમ સાથે OLAએ આ નવા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

શૂન્યમાંથી સર્જન કરનાર OLANA ભાવિશ અગરવાલના કહેવા પ્રમાણે આ નવા સાહસથી લગભગ ૧૦૦૦૦ નવી નોકરીઓનું નિર્માણ થશે અને દેશને નવી ટેકનોલોજી કે જે પ્રદુષણ મુક્ત ઇલેક્ટ્રીક સ્કુટર્સ દ્વારા આપવાનું પણ ગૌરવ અપાવશે.

આ ટેલેન્ટેડ યુવાન નવી પેઢી માટે અનુકરણીય અને પ્રેરણારૂપ છે.

જેજેસીના દરેકે દરેક સેન્ટરના પદાધિકારીઓ અને મેમ્બરો ધ્યાન આપશો

“કોરોના સંક્રમણ પ્રકોપ”ની અસર અનેક પરિવારો પર થી છે. કોઈ પરિવારે આપતજનને ગુમાવ્યાં છે તો અનેક પરિવારોએ હોસ્પિટલના ખર્ચને કારણ કે દવાઓના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નોકરી ગુમાવનારા તથા નોકરીમાં પગારમાં કપાત થઈ હોય એવા પણ અનેક યુવાનો છે. તો, પોતાનો ધંધો-વ્યવસાય કે દુકાન ધરાવતાં લોકોએ પણ આર્થિક ખેંચનો સામનો કરવો પડ્યો છે.

‘જાગૃતિ સંદેશ’માં ખાસ એક પાનું, આગામી અંકોમાં ‘નોકરી-ધંધા વ્યવસાય’ માટે ફાળવવાનું નક્કી કર્યું છે.

આ પાના પર નોકરી ઇચ્છુકો તથા જેમને પોતાને ત્યાં જરૂરી સ્ટાફની નિમણૂક કરવી છે એ વિગતો પ્રકાશિત કરાશે... જેથી સમાજનું ભુદ્ધિ ધન સમાજને કામમાં આવે.

વિવિધ પ્રકારના વ્યવસાય કરતાં, નાના-મોટાં પાયે ઉત્પાદન કરતાં સભ્યો પોતાની જાહેરાત/માહિતી મોકલી શકે છે જે અત્રે પ્રગટ કરાશે. જેનો લાભ સમસ્ત જેજેસી પરિવારને મળશે.



JOB OPENINGS

Require Young & Dynamic
FEMALE Candidates for
Marketing & Sales Profile
in Office at
Vikhroli (W), Mumbai

Required Skills

Graduate Females
Fluent English
(English Medium Educated)
Computer Knowledge with
MS-Excel, Outlook.
Excellent Communication.

Self Motivated, Dedicated and
Career Oriented Candidates
can call for Appointment

SIBRAM PHARMACEUTICAL

Tel: + 91 9819532366, 9967035493

Email: vimalkhokhani@gmail.com



રાષ્ટ્રસંત પરમ પૂજ્ય
નમ્રમૂનિ મહારાજ સાહેબને
૫૧માં જન્મદિવસ અવસરે
જેજેસીના ૧૭૩ સેન્ટર્સના ૬૫,૦૦૦ સભ્યો વતી
કોટી કોટી વંદન

લી.

જીતેન્દ્ર એસ. કોઠારી
ચેરમેન

જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ



પ્રફુલ વી. કામદાર
ચેરમેન

જેજેસી સેન્ટ્રલ બોર્ડ

અત્યાધુનિક 'ઝાયનોવા શાલ્બી હોસ્પિટલ' જે જે સી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વાઈસ ચેરમેન શ્રી રમેશભાઈ મોરબિયાના હ

મેડિકલ ક્ષેત્રે નવા યુગનો આરંભ

હાલમાં આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં સ્વાસ્થ્યને સહુથી વધારે મહત્વ આપવાની આવશ્યક છે. મેડિકલ ક્ષેત્રે દર રોજ નીતનવી ટેકનોલોજી અને રિસર્ચ થકી હવે આમ જોવા જઈએ તો વિવિધ રોગોનું નિદાન અને નિવારણ સારી રીતે કરી શકાય છે. પરંતુ, એ માટે જરૂરી છે અદ્યતન ઉપકરણો અને આધુનિક પદ્ધતિથી સજ્જ એવા હેલ્થકેર સેન્ટરની! અને આવી એક સુસજ્જ હોસ્પિટલનો એટલે કે 'ઝાયનોવા શાલ્બી મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલ'નો શુભારંભ હાલમાં જ ઘાટકોપર ખતે જેજેસી સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટી અને વાઈસ ચેરમેન શ્રી રમેશભાઈ મોરબિયાના વરદહસ્તે સંપન્ન થયો હતો. મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલો તો મુંબઈમાં અનેક છે, પરંતુ ઉત્તર પૂર્વ મુંબઈમાં સુયોગ્ય સુવિધાઓ એક છત્ર હેઠળ ન હોવાને કારણે લોકોએ છે...ક...દક્ષિણ મુંબઈ કે પશ્ચિમ મુંબઈ તરફ નજર દોડાવવી પડતી હતી.

ઝાયનોવા શાલ્બી મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલનો આરંભ ઘાટકોપરમાં થવાથી મધ્ય મુંબઈના ઉપનગરો વિકોલી, કાંજુરમાર્ગ, પવઈ, ભાંડુપ, કુર્લા, અસલ્ડા-સાકીનાકા વગેરેમાં વસતાં પરિવારોને હવે વિવિધ પ્રકારના રોગોની ચિકિત્સા / સારવાર નિષ્ણાત તબિબોની દેખરેખ હેઠળ અત્યાધુનિક, હાય-ટેક અને કાર્ડિયસ્ટાર હોસ્પિટલમાં મળી શકશે.

૧૫૦ બેડની હોસ્પિટલ

ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલ સગવડતાઓ ભરેલાં સુસજ્જ ૧૫૦ બેડ ધરાવે છે. તદ્દન ઉપરાંત હોસ્પિટલની પેનલ પર ૧૩૦ સ્પેશ્યલિટી ડોક્ટર્સ (નિષ્ણાત તબિબો)ની ટીમ છે. હાર્ટ સ્પેશ્યલિસ્ટ, ઓર્થોપેડિક, એન્કોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, મેકોલોજિસ્ટ સહિત વિવિધ પ્રકારના તજ તબિબોની કોજ પેશન્ટસને સાજાં કરવા માટે આ

સેન્ટ્રલ સબર્બ્સમાં રહેનારાઓએ હવે અત્યાધુનિક મેડિકલ સારવાર માટે સાઉથ મુંબઈ નહીં જવું પડે : ગઈ છે ઝાયનોવા શાલ્બી મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલ : નિષ્ણાત ડોક્ટરની મોટી ફોજ ધરાવતી આ મલ્ટિ હોસ્પિટલમાં સારવાર ઉપરાંત રોગને ઓળખી કાઢતો રેડિયોલોજી વિભાગ પણ છે : દાંતથી લઈને કેન્સર મોડર્ન સારવાર જો તમને ઘરઆંગણે મળી જાય તો આજના જમાનામાં એના જેવી સુખાકારી બીજી કઈ

હોસ્પિટલમાં સજ્જ છે.

મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલ

ઘાટકોપરમાં ઝાયનોવા હાર્ટ હોસ્પિટલ ૧૨ વર્ષથી કાર્યરત હતી જે હવે વિસ્તારિત થઈને ઝાયનોવા મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલ બની છે જેનો લાભ હવે વિવિધ પ્રકારની ચિકિત્સા માટે મળી શકશે. અહીં એન્કોલોજી

રેડિયોલોજી વિભાગનો આરંભ

વ્યક્તિ કઈ બિમારીથી પિડાય છે કે એને શું તકવિક્ક થઈ છે એ જાણવા-સમજવા માટે સહુપ્રથમ એનું પરિક્ષણ કરીને સચોટ નિદાન થવું અતિ આવશ્યક હોય છે. શરીરની આંતરિક તપાસણી જો અત્યાધુનિક ટેકનિક અને ઉપકરણોની મદદથી કરવામાં આવે તો સચોટ નિદાન કરી

કારગત નિવડી છે. ન્યુરોલોજી બિમારીના ઈલાજમાં તો રેડિયો જગાવી છે.''

હાલમાં જ આ વિભાગ મોરબિયાએ ક્યુ એ સાથે હો નવો અધ્યાય હાર્ટ-ટેક આ ઉમેરાઈ ગયો છે.

આધુનિક ઉપકર

સીટી સ્કેન, ઉચ્ચતમ કક્ષાના MRI, USG અને સોનોગ્રાફી ઉપકરણો તથા રોગીઓની સ્વેબોરેટરી સાથે આ હોસ્પિટલ

એમ્બ્યુલ

હોસ્પિટલની પાસે પં દર્દીઓને પાંચ કિલોમીટર વિ કરાશે.

જૈન ભોજન

દર્દીઓ તેમ જ તેમના પરિ પાસ જૈન ભોજન તથા વ્યંજનો

વેકિસ

ઝાયનોવા શાલ્બી મલ્ટિ વેકિસનેશન ઝુંબેશ પણ ચાલી ઉપલબ્ધ થયા બાદ એ વેકિસ કરાશે. આ વેકિસનનો પ્લર વચ્ચેનો સમયગાળો માત્ર બે સ વર્લ્ડ હાર્ટ-ટે

ઝાયનોવા શાલ્બી મલ્ટિ: માટે વર્લ્ડ હાર્ટ કે નિમિત્તે વિ આયોજિત કરાશે જે દર ઉપચારમાં વિશેષ ડિસ્કા તદઉપરાંત, આ વિષયપર કરવામાં આવશે.

ઘાટકોપરને મળી ર

સુવિધાઓ આપતી

મલ્ટિ સ્પેશ્યલિટી

લાભ મળશે સમગ્ર



અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આંતર રાષ્ટ્રીય કક્ષાનો દર્દીઓ માટેનો ખંડ

વિશાળ અને ભવ્ય વેઈટિંગ લોન્જ તથા રિસેપ્શન કાઉન્ટર

વિશેષજ્ઞ, કાર્ડિયોલોજી, કેન્સર અને ચિકિત્સા વિજ્ઞાનની હાર્ટ-ટેક શાખા કહી શકાય એ રેડિયોલોજી વિભાગ પણ મોજુદ છે. એ ઉપરાંત આધુનિક મેમોગ્રાફી, MRI મશીન અને સીટી સ્કેન મશીન પણ ઉપલબ્ધ છે.

જેને કારણે દર્દીને દરેક પ્રકારની શારિરિક યકાસણી (ચેકઅપ) માટે સરળતા રહે છે, બહાર નથી જવું પડતું.

શકાય છે અને એકવાર નિદાન થઈ જાય તો એની સારવાર કે ઉપચાર કરવા માટેની સાચી દિશા મળી શકે છે. શરીરમાં ઉદભવતી ગરબડોને પકડી પાડવાનું કામ રેડિયોલોજી વિભાગના અત્યાધુનિક ઉપકરણો માટે સાવ સરળ છે. અને એકવાર શરીરમાં આકાર લેતાં રોગની ઓળખ થઈ જાય પછી તેના ઉપચારમાં સરળતા રહે છે. બ્રેઈન સ્કેન / બ્રેઈન એટેક, બ્રેઈન હેમરેજ વગેરે કોઈપણ વ્યક્તિને, કોઈપણ સમયે શિકાર બનાવી શકે છે. અભ્યાસ થકી સમજાવું છે કે દેશમાં બ્રેઈનની બિમારી ને કારણે મૃત્યુ થવામાં ત્રીજું સ્થાન છે તો શરીરને ક્ષતિગ્રસ્ત કરી મૂકવાનું સહુથી મોટું ભીજું કારણ છે. ઝાયનોવા મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલના બિઝનેસ હેડ શ્રી આશિષ શર્મા કહે છે,

“મેડિકલ ક્ષેત્રે થતાં આવિષ્કારોની વચ્ચે રેડિયોલોજી ટેકનિક હવે માત્ર તપાસ કરવા સુધી જ સિમિત નથી રહી પણ ટ્યુમરથી લઈને જટિલમાં જટિલ ઓપરેશનોમાં પણ

હોસ્પિટલ'નું ઉદ્ઘાટન લ ટ્રસ્ટના ટ્રસ્ટી અને બિયાના હસ્તે સંપન્ન થયું

ઉચ મુંબઈ નહીં જવું પડે : ઘાટકોપરમાં આવી
પોટી ફોજ ઘરાવતી આ મલ્ટિ સ્પેશ્યલિટી
લા છે : દાંતથી લઈને કેન્સર સુધીની અલ્ટ્રા
સાઉન્ડ સુખાકારી બીજી કઈ હોઈ શકે?

કારગત નિવડી છે. ન્યુરોલોજી અને કેન્સર જેવી ગંભીર
બિમારીના ઈલાજમાં તો રેડિયોલોજી પદ્ધતિએ નવી આશા
જગાવી છે."

હાલમાં જ આ વિભાગનું ઉદ્ઘાટન શ્રી રમેશભાઈ
મોરબિયાએ ક્યુ એ સાથે હોસ્પિટલના ઈતિહાસમાં એક
નવો અધ્યાય હાઈ-ટેક આધુનિક ટેકોનલોજીને કારણે
ઉમેરાઈ ગયો છે.

આધુનિક ઉપકરણોથી તપાસણી
સીટી સ્કેન, ઉચ્ચતમ કક્ષાના અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે,
MRI, USG અને સોનોગ્રાફી ઉપરાંત હાઈ-ટેક આધુનિક
ઉપકરણો તથા રોગીઓની સારવાર માટે ઈન્વેસ્ટિગેટિવ
લેબોરેટરી સાથે આ હોસ્પિટલ સજજ છે.

એમ્બ્યુલન્સ સેવા
હોસ્પિટલની પાસે પોતાની એમ્બ્યુલન્સ છે કે જે
દર્દીઓને પાંચ કિલોમીટર વિસ્તાર સુધી નિ:શુલ્ક ઉપલબ્ધ
કરાશે.

જૈન ભોજન વ્યવસ્થા
દર્દીઓ તેમ જ તેમના પરિવારજનોને ધ્યાનમાં રાખીને
પાસ જૈન ભોજન તથા વ્યંજનો ઉપલબ્ધ રહેશે.

વેકિસનેશન
ઝાયનોવા શાલ્કિ મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલમાં
વેકિસનેશન ઝુંબેશ પણ ચાલી રહી છે. સ્પુતનિક વેકિસન
ઉપલબ્ધ થયા બાદ એ વેકિસન પણ આપવાની શરૂઆત
કરાશે. આ વેકિસનનો પ્લસ પોઈન્ટ એ છે કે બે ડોઝ
વચ્ચેનો સમયગાળો માત્ર બે સપ્તાહનો જ છે.

વર્લ્ડ હાઈ-ડેની ઉજવણી
ઝાયનોવા શાલ્કિ મલ્ટિ સ્પેશ્યલિટી ખાતે એક મહિના
માટે વર્લ્ડ હાઈ ડે નિમિત્તે વિવિધ જનોપયોગી પ્રવૃત્તિઓ
આયોજિત કરાશે જે દરમિયાન હાઈના પેશન્ટસને
ઉપચારમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તદઉપરાંત, આ વિષયપર જાગૃતિ ફેલાવવાના પ્રયાસ
કરવામાં આવશે.

ઘાટકોપરને મળી અત્યાધુનિક મેડિકલ
સુવિધાઓ આપતી દરેક રીતે સજજ
મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલ જેનો
લાભ મળશે સમગ્ર નોર્થ ઈસ્ટ મુંબઈને



હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી વસંત જાધવે
રમેશભાઈ મોરબિયાને પુષ્પગુચ્છ અર્પણ કર્યો



અત્યાધુનિક ઉપકરણોથી સજજ
આંતર રાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય ઓપરેશન થિયેટર



અત્યાધુનિક ઉપકરણોથી સજજ
ડેન્ટલ ચિકિત્સા વિભાગ



જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી
અને વાઈસ ચેરમેન શ્રી રમેશભાઈ મોરબિયાના
વરદહસ્તે રિબિન કાપીને
ઝાયનોવા શાલ્કિ મલ્ટિ સ્પેશ્યલિટી હોસ્પિટલનું
વિધિવત ઉદ્ઘાટન સંપન્ન થયું



આંતર રાષ્ટ્રીય કક્ષાનો
અત્યાધુનિક MRI સેટઅપ
આ મશીન મેમોગ્રાફી માટે
મોસ્ટ એડવાન્સ ગણાય છે



ઝાલાવાડ ચેરીટેબલ ટ્રસ્ટ
શ્રી ઝાલાવાડી સ્થા. જૈન મિત્ર મંડળ
ઝાલાવાડ લેડીઝ ગ્રુપ



જૈન સોશયલ ગ્રુપ
જુહુ બીચ સેન્ટર
સંગિની ફોરમ જુહુ બીચ

Shop No. A/30, Laram Centre CHS Ltd., S. V. Road, Near Bus Stand, Andheri West, Mumbai - 400 058.
Tel.: 93215 51455 E-mail : cvshahjsg@gmail.com



FREE MEGA CATARACT CAMP

Dr. Vaishal Kenia

M.B.B.S., M.S., D.N.B., D.O.M.S., F.C.P.C., I.C.O. (UK)

રજીસ્ટ્રેશન ચાર્જ્સ : રૂ. ૫૦૦/- વ્યક્તિદીઠ

આંખમાં મોતિયો - મોતિળીંદુ આવે તો બધું ધુંધળું દેખાય, જોઈ ન શકાય, પ્રાયઃ જીવન જીવવું વધુ અશક્ય થઈ જાય. અધરૂ બની જાય, આવા સમયે....

આધુનિક - અદ્યતન ટેકનોલોજી દ્વારા મોતિયાનું ઓપરેશન કરાવવાથી આંખોને નવી દ્રષ્ટિ મળે છે, ને દુનિયાને જોઈ શકે છે, જીવન જીવવા માટે એક નવું બળ પ્રાપ્ત થઈ શકે છે.

કારમી મોંઘવારી, કોરોનાથી ઠપ્પ થઈ ગયેલા નોકરી ધંધાને લીધે, ખર્ચાળ ઓપરેશનને લીધે લાચાર, દયાજનક પરિસ્થિતિમાં મૂકાઈ ગયેલા મુંબઈમાં વસતાં કોઈપણ ફિરકાના જૈનો માટે **ફ્રી**

ઝાલાવાડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત **MEGA CATARACT CAMP** નું આયોજન **KENIA EYE HOSPITAL**

102, D-Wing, Rizvi Nagar, S.V. Road, Near Milan Mall, Santacruz (W) ખાતે કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં **શ્રીમતી શ્રુતિબેન મયંકભાઈ શાહ**નો આર્થિક સહયોગ સાંપડ્યો છે.

જેના રોમ રોમમાં જૈનોનું ઝાલાવાડનું હિત સમાયેલું છે, એવા અનુકંપાદાનના પ્રખર હિમાયતી **શ્રી સી. વી. શાહ - પેરેડાઈઝ** પ્રસ્તુત કેમ્પના પ્રેરણા દાતા છે. તો આપનું નામ વહેલી તકે રજીસ્ટર કરાવી લેવા વિનંતી.

CATARACT OPERATION માટે આપનું નામ **SHRADHDHA - 75064 99962** ઉપર **Whatsapp** કરવા વિનંતી.
નામ નોંધાવવાની છેલ્લી તા: ૩૦-૯-૨૦૨૧ • સમય : સવારે ૧૧ થી ૬ strictly

દીપક ગાંધી - કન્વીનર
૯૮૨૦૧ ૫૦૫૨૦

'ઝાલાવાડ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા અત્યાર સુધીમાં કોરોના કાળમાં ૩૫ લાખથી વધુની રકમ અલગ અલગ રીતે વાપરવામાં આવી છે. જેમકે **PPE KIT** નું વિતરણ, **ફૂટનું** વિતરણ, અનાજ વિતરણ, રોકડ રકમની આર્થિક સહાય, માર્ક વિતરણ, થર્મોમિટર, આકસીમીટર વિતરણ, શૈક્ષણિક સહાય.... દરેક દાતાશ્રીઓનો ખાસ આભાર....

સી.વી. શાહ

ચેરમેન - ઝાલાવાડ ચેરીટેબલ ટ્રસ્ટ

અશોકભાઈ જસવાણી
JSG જુહુ બીચ
પ્રમુખ

પ્રિતી શાહ - તારિકા શાહ
ઝાલાવાડ લેડીઝ ગ્રુપ
પ્રમુખ

ડો. વિનોદભાઈ શેઠ
ઝાલાવાડી મિત્ર મંડળ
પ્રમુખ

ભાવિની મહેતા
JSG સંગિની ફોરમ
પ્રમુખ

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧

Adv.

गुरु की शरण ही है मोक्ष द्वार की ओर प्रयाण के लिए प्रथम चरण

परम पवित्र प्रभु महावीर स्वामी भी आमआदमी की तरह पंच महाभूत से बने जन सामान्य ही थे।

हमारी तरह उन्हें भी तन-मन-आत्मा-आचार-विचार-व्यवहार का वहन करना साभाविक था। उन्होंने भी संसारचक्र के विविध पहलुओं का अनुभव प्राप्त किया, जीवन के व्यवहारों का अनुसरण किया। उनके जीवन में कौनसा तत्व-सत्त्व था? जिसे अगर हम अपनाएं तो हम भी उच्च स्थान की ओर अग्रेसर हो सकते हैं?

मानव अगर प्रयास करें, भाव जागृत हो, तो भगवान बन सकता है। क्योंकि मानव उसी चेतना, उसी आत्मा का अंश है जो परमतत्त्व, शुद्ध चेतन कहलाता है।

प्रकृति ने मानव की शुद्ध चेतना व मन का मिलाप कर के उत्तम कर्मों का वहन करने हेतु सर्जन किया है।

संसार में जीव जब प्रवेश करता है तो शरीर एवम् मन विविध स्वभाव के कारण उर्ध्वगामी भी हो सकता है, या अधोगामी भी हो सकता है। जीव अपने कर्मों के अनुसार फल प्राप्ति करता है।

प्रभु महावीरने अपने जीवन में मानव स्वभाव के हर प्रकार के कशायों को समजा व उनका चयन किया। काम, क्रोध, मद, लोभ, शंका-कुशंका, स्नेह, धिक्कार आदि अनेक प्रकार के स्वभाव की निर्जा करते हुए वे आत्मोन्नति की ओर बढ़ते ही चले और अंततः मोक्ष प्राप्ति कर ली।

इस प्रकार मानव से महामानव और महामानव से देवत्व को प्राप्त करना हर किसीके लिये संभव है।

जीव को उर्ध्वगामी होने के लिये आवश्यकता है, सुयोग्य मार्गदर्शन की। जिन्हे सद्गुरु मिल जाये उन्हें मार्गदर्शन सहज प्राप्त हो सकता है।

हमारी सनातन संस्कृति में गुरु का विशेष महिमा दर्शाया गया है।

मोक्ष मार्ग से भटके हुए मानव को सद्गुरु का सानिध्य प्राप्त हो जाय तो उनके मार्गदर्शन के फल स्वरूप उसे सहि दिशा, सहि मार्ग प्राप्त हो जाता है। आचार

आत्मिक ज्ञान प्राप्त सद्गुरु स्वयं को मोक्षमार्ग की ओर ले जाते हैं और साथ ही अपने आश्रय आये हुए उनके शिष्यों को भी सन्मार्ग की ओर प्रशस्त करते करते, उनके अंदर छूपे हुए कशायों को दूर करने में सहायरूप होते हैं।

अन्य व्यक्ति को धर्म के मार्ग पर लाने की चेष्टा करने से भी पुण्योदय संभव होता है।

गुरु की शरण, गुरु के चरण...

जिनको प्राप्त हो जाय, बस समज लें

उनका बेडा पार हो जाय...

जन्म जन्म के फेरों से मुक्त होकर

वह जीव परम तत्व में एकाकार हो जाय।

ધર્મ સાથે

■ ડૉ. સેજલ શાહ

ધર્મ સર્વ જીવોના સુખની સહજ અપેક્ષા રાખે છે. મારાસ જે સુખ બહાર ભૌતિકતામાં શોધે છે, તેને ધર્મ અંદર શોધવાનું કહે છે. અર્થ અને આકાર એકવાર સમજાઈ જાય પછી કોઈ મૂંઝવણ રહેતી નથી. દરેકનો તેના સ્વભાવ પ્રમાણેનો સ્વીકાર કરી લીધા પછી કોઈ જ અજંપો નથી રહેતો. જ્યાં સુધી તરસ લાગતી નથી ત્યાં સુધી મનુષ્ય પાણીની શોધ કરતો નથી, પણ પાણીની તરસ સાથે તે ચારેતરફ નજર ફેરવી પોતાની તરસનું મારણ શોધી જ લે છે. એ જ રીતે જ્યાં સુધી જ્ઞાનની તલપ જાગતી નથી, ત્યાં સુધી આપણે ધર્મને સમજવાના મૂળમાં ઊંડા ઊતરતા નથી. ઉપરછલ્લી રીતે ધર્મનો પરિચય થયેલો હોય જ છે, પણ એ ક્ષણિક હોય છે, તેમાં ક્રિયા હોય છે, સમજણ કદાચ હોય, કદાચ ન હોય. મહત્ત્વ તો ક્રિયાનું પણ એટલું જ છે અને એથી પણ વધુ મહત્ત્વ સાધ્ય / પરિણામનું. સત્ય એ જ્ઞાનનો ગુણ છે તો જ્ઞાન જે માર્ગ વડે અને જે માધ્યમ દ્વારા મળે છે તેનું પણ મહત્ત્વ છે. (૨) વ્યક્તિની શક્તિનો પૂર્ણ વિકાસ શેના આધારે થાય છે? સત્યને જાણીને, સમજીને, પ્રમાણીને આચરણમાં મૂકી ચરિત્રનો ભાગ બનાવવો પડે છે. કર્મની સાચી સમજણ, અહંકારમાંથી નિરાકાર કેવી રીતે થવું અને વ્યવહારમાં વિનય - વિવેક કેમ જાળવવા તે સમજવું પણ ધર્મનો જ ભાગ છે. દર્શન એટલે માત્ર તાત્વિક ભૂમિકા માત્ર નહીં, પણ વ્યવહારની ભૂમિકા પર પણ એનો સમાવેશ કરવો પડે છે.

આપણે ધર્મને ક્રિયા, જ્ઞાન અને ભક્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજણથી ચરિત્રનું ઘડતર થાય છે અને મનુષ્ય પોતાને અને તે દ્વારા બીજાને પામે છે અને એમાંથી સુખની સાચી વ્યાખ્યા પ્રગટે છે. વિશ્વના અટળક વિચારકોએ ધર્મની સમજણ આપતા સંતોષ, સેવા, કુદરત પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો છે, પણ કોઈએ એમાંથી મનુષ્યત્વની બાદબાકી નથી કરી. આપણે જે ધર્મ લાવ્યા તેમાં દેવતત્ત્વની ભક્તિ સાથે આત્માને જોડવાને બદલે માત્ર અન્યને જ જોડ્યા, મૂળ ગતિ અંદર

તરફની હતી, તે વાત રહી ગઈ અને પરિણામે ધર્મ ભાર બન્યો. ધર્મને વ્યવહારની ભૂમિકા પર લાવવો અને સાથે એનાં દર્શનના મૂળતત્ત્વનો પરિચય કરાવવો, એ 'ધર્મનું' પાયાનું કાર્ય છે.

ધર્મનો હેતુ ધર્મને જીવનનાં મૂલ્ય, દર્શન, જ્ઞાન અને આત્મજાગૃતિ માટેનું માધ્યમ બનાવવાનો છે. સાંપ્રદાયિક સંકડાશમાંથી મુક્ત કરીને ધર્મને આવશ્યક ગુણ બનાવવાનો છે. જ્યારે લોકોની સાંભળવાની શક્તિ ક્ષીણ થઈ રહી છે, ઘોંઘાટ વધી રહ્યો છે ત્યારે આ સામયિક આંતરરાષ્ટ્રીય ભાષામાં, ઓનલાઈન અને જૈન ધર્મને અનુસરનારા માટે એક સમ્યક્ત્વ અને આત્મજાગૃતિનો સૂર લઈને આવ્યું છે. જૈન ધર્મના શ્રદ્ધેય માત્ર નહીં, પરંતુ જે વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકાય એવાં તત્ત્વોને પ્રજા સમક્ષ લાવીને ઉજાગર કરવાં જરૂરી છે. આત્માનું આત્માપણું ટકી રહે અને તેમાં શ્રદ્ધા જન્મે એ બહુ જ મહત્ત્વની બાબત છે. સમ્યક્દર્શન, જ્ઞાન અને ચરિત્ર જીવનને સુખાકારી બનાવવા માટે ઉપયોગી છે. દરેક મનુષ્યમાં સ્વભાવના ભાગરૂપે તેનામાં રાગ-દ્વેષ-ઈર્ષ્યા હોય છે. કાઉન્સિલર કહે છે કે, આ વ્યવહારગત ભાવથી મુક્તિ મેળવવી બહુ જ અઘરી છે, તે માટે નિર્વેદ, તુલનામુક્ત અને સંતોષી સ્વભાવ વિકસાવવો પડે, તો સાથે અન્ય જીવોની કાળજી માટે કરુણા સ્વભાવનો ભાગ બને તો અહિંસા આપોઆપ જીવનનો વ્યવહાર બને.

વિચારોની સ્વચ્છતા અને આત્માનું અલૌકિક પરમાત્મામય રૂપ બંને સમાંતરે ચાલતી પ્રક્રિયા છે. સત્યશોધનની વૃત્તિ માટે હૃદય અને તર્કનો સમન્વય આવશ્યક છે. બુદ્ધિ ઘણી વાર તૈયાર ન થાય અને સત્ત્વના વિકાસમાં અવરોધ નિર્માણ થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી અંદરનું ડહાપણ વિકસે છે. અશુભ તત્ત્વ સાથે અંતર કેળવીને ચરિત્રનો વિકાસ થાય છે. ટૂંકમાં જીવન પ્રત્યેનો આદર, અહિંસા, ઘ્યાભાવ, ઈન્દ્રિયોને જીતવાનું બળ પ્રાપ્ત થાય છે. વૈશ્વિક પ્રેમ એ જીવ માત્ર માટેની અનુકંપા સહજ પ્રાપ્ત થાય છે. ધર્મને સમજતાસમજતા આપણે દરવાજો ખોલવાનો છે.



જે જે સી નોર્થ ઈસ્ટ




જે જે સી નોર્થ વેસ્ટ

જે જે સી જેમ જગડુશા

જે જે સી રોયલ જગડુશા

D. D. Rashtriya Shala Compound, Hingwala Lane, GHATKOPAR (East), Mumbai - 400075. Tel.: 2501 0420 / 2501 0078



કેન્દ્ર સરકારની
માયનોરિટી
સ્કોલરશીપ
યોજનાનો
લાભ લેવા માટે
ઓનલાઈન ફોર્મ
ભરવા ફરજિયાત છે

વેબસાઈટ : www.scholarships.gov.in

ઉપર સોમવાર, તા. ૧૫ નવેમ્બર સુધી આવેદન કરી શકાશે

<p>ધોરણ ૧ થી ૧૦ સુધી 'પ્રિ મેટ્રિક સ્કોલરશીપ'</p> <p>જેમના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. ૧ લાખથી ઓછી હોય</p>	<p>ધોરણ ૧૧ થી કોલેજ સુધી 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ'</p> <p>જેમના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. ૨ લાખથી ઓછી હોય</p>	<p>પ્રોફેશનલ તથા ટેકનિકલ કોલેજમાં એડમિશન લેનારાં અથવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 'મેરિટ કમ મિન્સ'ના ઓપ્શનમાં આવેદન કરે</p> <p>જેમના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. ૨.૫ લાખથી ઓછી હોય</p>
--	---	--

આ પરિપત્રમાં આપેલ માર્ગદર્શક મુદ્દાઓ ધ્યાનથી વાંચીને વેબસાઈટ ખોલીને આપનું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરશો

ફોર્મ ભરતાં પહેલાં તૈયાર રાખવા જરૂરી દસ્તાવેજોની યાદિ

(૧) વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (૨) ઈન્સ્ટીટ્યુટ વેરિફિકેશન ફોર્મ (૩) આવકનું પ્રમાણપત્ર Income Certificate from Tahesildar Office (૪) જૈન માયનોરિટી સર્ટિફિકેટ (૫) ગત શૈક્ષણિક વર્ષની સ્વ-પ્રમાણિત માર્કશીટ, કે જેમાં ૫૦ ટકાથી વધુ માર્ક મેળવેલાં હોવા જરૂરી છે. (૬) હાલના શૈક્ષણિક વર્ષની ફી રસીદ (૭) વિદ્યાર્થીના નામનું બેન્ક એકાઉન્ટનું પ્રૂફ / પાસબુકના પહેલાં પાનાની કોપી (૮) આધાર કાર્ડ (૯) રહેણાંકનું પ્રમાણપત્ર / રહેઠાણનો પુરાવો.

જે વિદ્યાર્થીઓએ ગયાં વર્ષે સ્કોલરશીપનો લાભ લીધો છે, તેમણે 'રિન્યુઅલ' ઓપ્શનમાં જઈને ગયાં વર્ષની આઈડીથી જ Apply કરવાનું છે. જે પણ વિદ્યાર્થીઓએ ગયાં વર્ષે લાભ લીધો હોય, પણ આ વર્ષે, ઘર અથવા તો શાળા / કોલેજ બદલ્યાં હોય તો તેઓએ આ વર્ષે New User તરીકે Apply કરવું. જેમણે મોબાઈલ નંબર બદલ્યો હોય તેઓએ પણ New User તરીકે Apply કરવું. સ્કોલરશીપનો પ્રકાર બદલાયો હોય એટલે કે પિ-મેટ્રિક થી 'પોસ્ટ મેટ્રિક' વગેરે...તો પણ New User તરીકે Apply કરવું.

માયનોરિટી (અલ્પસંખ્યક) પ્રમાણપત્ર આપ સ્વયં બનાવી શકો છો

<https://tinyurl.com/9p5ssppj>

તમારે તમારું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર લોકસેવા કેન્દ્રમાં જઈને તહસિલદાર પાસેથી બનાવડાવવું પડશે.

વધુ માહિતી માટે સંપર્ક : ભરત પટેલ : 98198 62645 / પ્રફુલ મહેતા : 98200 68297
મયુર લોડાયા : 93223 11146 / પ્રવર કોટિયા : 92234 34460 / ભરત કામદાર : 93222 73784
સમય : સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ અને રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦

Ad Art

સ્પોર્ટ્સ રમત ગમત ક્ષેત્રે ભારતીયો શા માટે પાછળ ?

હાલમાં જ જાપાનમાં ટોક્યો ખાતે વર્લ્ડ ઓલિમ્પિક્સનું સમાપન થયું. ટોક્યો - ૨૦૨૦ ઓલિમ્પિક્સમાં કુલ ૮૬ દેશના એથલેટ્સ એટલે કે રમતવીરો એ ભાગ લીધો હતો. કુલ ૪૬ પ્રકારની રમતોમાં કુલ મળીને ૧૧, ૬૫૬ રમતવીરો સહભાગી બન્યાં હતાં. તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૧ થી તારીખ ૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલેલી આ મહાસ્પર્ધામાં ભારત તરફથી ૬૭ પુરૂષ તથા ૫૨ સ્ત્રી એથલેટ્સ મળીને કુલ ૧૨૭ ભારતીય રમતવીરોએ પોતાના કરતબ દર્શાવ્યાં હતાં. ભારતીય ખેલાડુઓએ ૧ સુવર્ણ ચંદ્રક (Gold), ૨ ચાંદી

(Silver) તથા ૪ કાંસ્ય (Bronze) એમ માત્ર ૭ ચંદ્રકો જ મેળવ્યાં હતાં.

વિશ્વ ઓલિમ્પિક્સનું શરૂઆત સન ૧૯૦૦ થી થઈ છે. ત્યારથી લઈને આજ સુધીમાં ભારતે કુલ મળીને માત્ર ૩૫ ચંદ્રકો (મેડલ્સ) મેળવ્યાં છે.

ટોક્યો - ૨૦૨૦ ઓલિમ્પિક્સમાં અમેરિકા સંયુક્ત રાષ્ટ્રે (USA) સહુથી વધુ ૧૧૩ ચંદ્રકો પ્રાપ્ત કર્યાં છે.

હાલમાં જે ટોક્યો ઓલિમ્પિક્સ - ૨૦૨૦ યોજાઈ તેમાં છેલલાં ચાર દાયકાના ઈતિહાસમાં પ્રથમ જ વાર ભારત ૪૮માં સ્થાને પહોંચી શક્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૦૮ માં બિજિંગ ખાતે આયોજિત ઓલિમ્પિક્સમાં ભારત ૫૧માં સ્થાને હતું. 'પેરા ઓલિમ્પિક્સ - ૨૦૨૦' માં ભારતીય રમતવીરોએ આજ સુધીમાં બધા જ રેકર્ડ્ઝ તોડીને ૧૯ ચંદ્રકો જીતી લાવીને ભારતીય પેરામિપિક્સ ઈતિહાસમાં નવી ઊંચાઈ અપાવી છે. પેરાલિમ્પિક્સમાં સહભાગી થનાર રમતવીરો વિવિધ પ્રકારે શારીરિક અથવા માનસિક




રીતે ક્ષમતા ધરાવતા લોકો માટે આયોજિત થાય છે.

સહુ પ્રથમ સન ૧૯૦૦ માં ભારત તરફથી એકમાત્ર એથલેટ (રમતવીર) નોર્મન પ્રિયાર્ડને પેરિસ ખાતે આયોજિત સમર ઓલિમ્પિક્સમાં સહભાગી થવા મોકલવામાં આવેલ જેમાં તેણે પુરૂષો માટેની ૨૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર વિઘ્ન સહિતની દોડમાં ૧-૧ એમ કુલ ૨ (બે) ચંદ્રકો જીત્યાં હતાં.

ત્યારથી લઈને આજ સુધીમાં પ્રત્યેક 'સમર ઓલિમ્પિક્સ'માં ભારતના એથલેટ્સ સહભાગી થતાં આવ્યાં છે.

ભારતની પ્રથમ ટીમ સન ૧૯૨૦માં ઓલિમ્પિક્સ રમતોમાં સહભાગી થઈ હતી. જેમાં ૪ એથલેટ્સ હતાં અને ૨ કુસ્તીબાજ ! પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, સન ૧૦૯૦૦ થી પ્રત્યેક ઓલિમ્પિક્સ





INDIA MEDALS IN OLYMPICS

સ્પર્ધામાં ભારતના રમતવીરો દરેકમાં સહભાગી થતાં રહ્યાં છે. અને સન ૧૯૮૮માં નોર્મન પિયાર્ટે જીતેલ બે ચંદ્રકો બાદ છે...ક...૧૯૨૮ સુધી એકપણ ચંદ્રક ભારતના રમતવીરો જીતી શક્યાં નહોતા.

ભારત દેશ આઝાદ થયો તે પહેલાં સન ૧૯૨૮માં હોકીવીર મેજર ધ્યાનચંદના કપ્તાનપદ હેઠળની ભારતીય ટીમે એમસ્ટરડમની ટીમ સામે ૩ ગોલ કરીને ભારતને માત્ર મેડલ જ નહોતો અપાવ્યો પરંતુ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. અને વિશ્વમાં રમત ગમત ક્ષેત્રે ભારતના ખેલાડીઓની હાજરીની નોંધ લેવાઈ હતી. હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદનું નામ હાલમાં જ સરકાર દ્વારા અગાઉ 'રાજીવ ગાંધી ખેલ રત્ન' પુરસ્કાર તરીકે હતું તેને બદલી ને હવે 'મેજર ધ્યાનચંદ ખેલરત્ન' જાહેર કરવામાં આવ્યું છે. એક મહાન ખેલાડીને દેશ તરફથી અપાયેલી આ સાચી અંજલિ છે.

હવે, પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં પોપ્યુલેશન

હોય એ દેશમાં હજુ સુધી વિશ્વસ્તરે આયોજિત થતી રમત-ગમતની સ્પર્ધામાં કે શરીર સૌખ્ય સ્પર્ધામાં હજુ સુધી શા માટે પછાત હોવાનું કલંક ચોટેલું રહ્યું છે?

આ સ્થાને આપણે રાજકારણમાં ન પડીએ. પરંતુ એક વાત તો ચોકકસપણે કહી શકીએ અને માનવી પણ પડશે કે દેશની આઝાદી પછીના વર્ષોમાં સરકારોએ કે રાજકારણીઓએ નેતાઓના નામ સ્પર્ધાઓ કે પુરસ્કાર સાથે જોડવા સિવાય વ્યક્તિગતરીતે રમતવીરોને તાલિમ મળી શકે કે આર્થિક રીતે પ્રોત્સાહન મળે એવા પ્રયાસો કદિ નથી કર્યાં. બસ, આપણે એક જ ગાણું ગતાં રહ્યાં કે, ગરીબ રાષ્ટ્રને કે



વિકાસશીલ રાષ્ટ્રને 'સ્પોર્ટ્સ' માટેનો ખર્ચ કરવો કેમ કરીને પરવડે? ખરેખર તો આપણે ક્રિકેટની ટુર્નામેન્ટ્સ તથા ક્રિકેટ ખેલાડીઓને જેટલું માન-સન્માન આપીએ છીએ એના ચોથા ભાગનું પણ જો ઓલિમ્પિક્સમાં સહભાગી થતાં રમતવીરોને આપીએ તો ભારતીય રમતવીરો વિવિધ ક્ષેત્રે પોતાનું કૌશલ દર્શાવી શકે તેમ છે. ગુજરાતમાંથી છ મહિલા રમતવીર થઈ સહભાગી

ગુજરાત પેરાલિમ્પિક્સ કમિટીના પ્રમુખ શ્રી કાન્તિભાઈ શાહ અન્ય રીતે સક્ષમ રમતવીરોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં સહભાગી થવા માટેનું અભિયાન સન ૧૯૭૭થી ચલાવી રહ્યાં છે. તેઓનું સ્વપ્ન ચાર દાયકાના લાંબા સમયગાળા બાદ ગુજરાતની છ દિ ક રી ઓ એ 'ટોકયો પેરાલિમ્પિક્સમાં સહભાગી થઈને પુરું કર્યું છે. એટલું જ નહીં, પણ પ્રથમવાર છ રમતવીર ગુજરાતમાંથી સહભાગી થયાં છે અને તે પણ ગુજરાતી યુવતિઓ! આમ ગુજરાતની નારીઓએ ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે.

એક અખબાર સાથેની મુલાકાતમાં ગુજરાતના પેરાલિમ્પિક્સ સ્પોર્ટ્સ કમિટીના સંકલનકર્તા શ્રી ગૌરવ પરિખે જણાવ્યું હતું કે,

“ગુજરાત સરકાર તરફથી મળતાં પ્રોત્સાહનના ફળસ્વરૂપે હવે જરૂર ગુજરાતના રમતવીરો ચંદ્રક મેળવી લાવીને ગુજરાતનું ગૌરવ વધારશે.”

ગાંધી તો એક નામ હતું, મૂળ વાત છે વિચાર અને દિશા

‘હિંદ સ્વરાજ’માંની મોટા ભાગની સલાહો જગતે કાને નથી ધરી, પણ અહિંસક લડતની એમની સલાહ સુપર હિટ સાબિત થઈ છે, રામચંદ્ર ગુહાએ એમના પુસ્તક ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ની પ્રસ્તાવનામાં ટાંક્યું છે: પાંચેક ડઝન સરમુખત્યારી શાસનોના અંત વિશેના અભ્યાસમાં એવું જોવા મળ્યું કે એમાંના ૭૦ ટકાથી પણ વધુ કિસ્સામાં હિંસક બળવાથી હારીને નહીં. બલકે બહિષ્કાર, હડતાળ, ઉપવાસ વગેરે જેવી ગાંધીવાદી લડતો સામે મૂકીને સરમુખત્યારી શાસનો લોકશાહી તરફ વળ્યા.

ગાંધીને ચિકિત્સાનો ભારે શોખ હતો. ૪૦ની ઉંમરે એ લંડનની મુલાકાતે આવ્યા ત્યારે પણ એમના મનમાં સહેજ સહેજ એવો વિચાર ચાલતો હતો કે મેડિકલ સાયન્સ ભણું. લંડનની એ મુલાકાત દરમિયાન તેઓ અનેક ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા. એમાંના એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે ભણતરના ભાગરૂપે એ પચાસેક દેડકા ચીરી (મારી) ચૂક્યો છે. આ જાણીને ગાંધી ભારે અકળાયા. આમ પણ એ દેશી દવા અને કુદરતી ઉપચારના માણસ હતા. એમાં વળી જ્યારે એમને એવી ખબર પડી કે એલોપથિક મેડિસિનના પ્રયોગોમાં તો અસંખ્ય જીવોની હત્યા થાય છે ત્યારે એમને ભારે તકલીફ થઈ. અલબત્ત, વ્યવહારુ ગાંધીએ એલોપથીનો આજીવન બહિષ્કાર નહોતો કર્યો. જીવનમાં એક તબક્કે એપેન્ડિક્સનું ઓપરેશન અનિવાર્ય જણાતાં એમણે એ ઓપરેશન કરાવેલું, પણ સરવાળે આધુનિક તબીબી વિજ્ઞાનથી ખાસ્સા દૂર રહીને પણ મૃત્યુ લગી, ૭૯ની ઉંમરે એ રાત્રી રાયણ જેવા રહી શકેલા એ સ્વીકારવું પડે.

‘હિંદ સ્વરાજ’માં રેલવે, વકીલો, દાક્તરોનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધને શબ્દશઃ લેવા જેવો નથી. એમ તો ‘હિંદ સ્વરાજ’ની ઘણી વાતોને શબ્દશઃ લેવા જેવી નથી. કંઈક અંશે ‘હિંદ સ્વરાજ’ની ઘણી વાતોને શબ્દશઃ લેવા જેવી નથી, કંઈક અંશે ‘હિંદ સ્વરાજ’કૂડ ઓઈલ જેવું છે. એમાં કેટલોક કચરો પણ છે. એમાં પુરુષવાદી-સામંતવાદી-જ્ઞાતિવાદી-વિજ્ઞાનવિરોધી-પ્રગતિવિરોધી માનસિકતાની ગંધ આવી શકે. બ્રહ્મચર્ય વિશેની વાતો અપકવ-ઈમેચ્યોર લાગી શકે તથા આધુનિકતાનો કેટલોક વિરોધ અવ્યવહારુ જણાઈ શકે,

પરંતુ એ બધી વાતો અને એવાં બધાં વાક્યોને વીણીને એના પર બિલોરી કાચ માંડવા જેવો નથી, કારણકે એવું કરવાથી ‘હિંદ સ્વરાજ’ નકામી ચોપડી લાગી શકે તેમ છે, પણ એ નકામી ચોપડી નથી. એ નથી ગીતા-કુરાન કે નથી રહી. એ કૂડ ઓઈલ છે. જિંદગીમાં પહેલી વાર ગાંધી પોતાની સમગ્ર વિચારધારા ઉશ્કેરાટ સાથે અને ઉતાવળે-હિંદ સ્વરાજરૂપે લખવા બેઠા ત્યારે વિચારો એ રીતે ભરભખભખ કરતાં બહાર આવ્યા છે, જાણે નવા ખોદેલા કૂવામાં કૂડ ઓઈલનો કુવારો છૂટ્યો હોય. એમાં ધૂળ, રેતી, કાદવ વગેરે ઘણુંબધું છે, પણ કૂડ છેવટે કૂડ છે. અત્યંત ઉપયોગી ચીજ, મુદ્દે, ‘હિંદ સ્વરાજ’માં વિમાની બળતણ-એવિયેશન ફ્યુઅલ જેવી પ્યોરિટીની અપેક્ષા રાખવા જેવી નથી. એ કૂડ ઓઈલને રિફાઈન કરીને પોતાને ઉપયોગી એવું પેટ્રોલ મેળવવાનો ઉદ્યમ સૌએ જાતે જ કરવો.

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ માં અમને પત્રકારોને પણ અડફેટે લીધા છે. એમણે લખ્યું છે: ‘છાપાનું’ કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે. બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે, ને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવી.’ કરો વાત, શું છાપાં ગાંધીજીની આ સલાહને અનુસરી રહ્યાં છે? શું આ સલાહને શબ્દશઃ અનુસરવી જોઈએ? શું લોકોને સલાહ-શિખામણ આપવાને નૈતિક અધિકાર અમે છાપાવાળા ધરાવીએ છીએ ખરા? શું છાપાં તમને તમારી ખરાબી, નાદાની, એબ ચીંધે તો તમને ગમે?

‘હિંદ સ્વરાજ’ કહે છે: માણસ ઊંઘમાંથી ઊંઠે છે ત્યારે આળસ મરડે છે. આમતેમ ફરે છે ને અશાંત હોય છે. તેને પૂરું ભાન આવતાં વખત લાગે છે... ઊંઘમાંથી ઊઠતા સદાય આળસ મરડવાની સ્થિતિમાં આપણે નથી રહેતા, પણ વહેલામોડા આપણી શક્તિ પ્રમાણે પૂરા જાગીએ છીએ. તેમ આ અશાંતિમાંથી આપણે જરૂર છૂટીશું. અશાંતિ કોઈને ગમતી વસ્તુ નથી.’ આ વાત ગાંધીજીએ બંગાળની ચળવળ બાદ વ્યાપેલી અશાંતિ વિશે કહેલી. એ ચળવળ પૂરી થયાને સદીથી પણ વધુ સમય વીતી ગયો છે અને આઝાદી મળ્યાને પણ ૬૭ વર્ષ થઈ ગયાં. પરંતુ હજુ પણ આપણે જાણે આળસ

જાગૃતિ સંદેશ

મરડવાની અવસ્થામાં જ હોઈએ એવું નથી લાગતું? શું આપણી પાર્લામેન્ટ પુખ્ત થઈ છે ખરી? શું એક પ્રજા તરીકે આપણે પૂરેપૂરા જાગૃત થઈ ચૂક્યા છીએ?

‘હિંદ સ્વરાજ’માં પ્રેક્ટિકલ બાબતો વિશેની ચર્ચામાં ગળાડૂબ રહેવાને લીધે ગાંધી પોતાની આધ્યાત્મિક વિચારણા બાબતે બહુ ખૂલ્યા નથી. છતાં ‘હિંદ સ્વરાજ’ વાંચતી વખતે કે ગાંધીને સમજતી વખતે એમના આ શબ્દો યાદ રાખવા: ‘મારું આખું જીવન, મારી સાધના, સત્યાગ્રહ વગેરે કામો પરમેશ્વરની ખોજ સારુ છે.’

‘હિંદ સ્વરાજ’નો કે આખેઆખા ગાંધીનો સમાજ પર ઝાઝો પ્રભાવ નથી પડ્યો એ હકીકત છે. ગાંધીને પોતાને આ હકીકત સ્વીકારવામાં ઝાઝી તકલીફ નહોતી. મરતાં પહેલાંના થોડા સમય દરમિયાન એ વ્યથિત હતા અને હવે તો ભગવાન ઉઠાવી લે તો સારું એવું એ બોલતાં એ પણ સાચું છે. પરંતુ પોતાના કાર્યથી જગત બદલાઈ જશે એવા ભ્રમમાં એ નહોતા. વિનોબાએ લખેલો એક પ્રસંગ જાણવા જેવો છે: એકવાર ગાંધીજીએ કોઈ બાબત માટે મને પૂછ્યું, ત્યારે મેં દવાબ આપ્યો કે મને નથી લાગતું કે આનું બહુ ઝાઝું પરિણામ આવશે.’ ત્યારે તેઓ હસતાં હસતાં બોલ્યા: ‘જો વિનોબા! આ યોગ્ય છે કે અયોગ્ય એ જ આપણે જોવાનું છે. બાકી હું માનું છું કે

આપણા કામનું ફુલ પરિણામ મીડું છે.’ અને આમ કહીને એમણે હવામાં પોતાના હાથે મીડું દોરી બતાવ્યું. આ દુનિયામાં ઈશ્વર સિવાય બીજું કોઈ હસ્તી નથી. આપણે તો આપણા સંતોષ ખાતર કામ કરીએ છીએ. બાકી પરિણામની દૃષ્ટિએ જોવું હોય, તો તો આપણી બધી ક્રિયાઓનું પરિણામ શૂન્ય છે. આ મીડામાં જ બાપુની આધ્યાત્મિક બેઠક હતી.’ આ હતા ગાંધી, આ હતા વિનોબા.

ગાંધી બરાબર જાણતા હતા કે પબ્લિક પબ્લિક છે. જગત જગત છે. એ કંઈ રાતોરાત ન બદલાય. એક ગાંધીથી ન બદલાય, પણ મોહન નામના એક ગાંધીએ ચીંધેલી દિશાનો લાંબા ગાળે પ્રભાવ પડી શકે ખરો. છેવટે, ગાંધી તો એક નામ હતું. એક શરીર હતું. મૂળ વાત છે વિચાર અને દિશા.

સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, સમાનતા, અસ્તેય, અપરિગ્રહ... આ છે મૂળ ચીજ. બુદ્ધ-મહાવીર-ઈસુ-મોહમ્મદ-પતંજલિ-ગાંધીપ્રેરિત આ વિચારો અને આદિશા હજારો વર્ષ પછી પણ જુનવાણી નથી બન્યાં. માનવજાત આ વિચારદિશા અપનાવે તો સારું! બસ ઈતની સી બાત હૈ, બસ ઈતના સા ખ્વાબ હૈ.

સૌજન્ય : સ્વદેશ મંથન

લગ્નઈચ્છુક યુવક-યુવતીઓની યાદી યુવક

નં	નામ, જ.તા., ઊંચાઈ, અભ્યાસ, વ્યવસાય	જ્ઞાતિ-મૂળ વતન-હાલ	સંપર્ક
૧)	ચિંતન અનિલ શાહ, ૨.૧૨.૧૯૮૪ ૫'૫', B.Com, Computer	જૈન વણિક ભાવનગર, હાલ ઘાટકોપર	(મો) ૯૭૭૩૨૬૧૨૮૧ (મો) ૯૮૬૭૮૦૮૭૨૭
૨)	કુણાલ જગદિશ સંઘવી, ૨૬.૭.૧૯૮૪ ૫'૫', B.Com., C.A.	જૈન વણિક ઉપલેટા, હાલ મુલુંડ	(મો) ૯૨૨૪૨૦૦૯૮૦ (મો) ૯૮૬૭૮૦૮૭૨૭
૩)	તુષાર રમેશભાઈ ગુથાણી, ૧૫.૫.૧૯૮૪ ૫'૪', B.Com, CA Inter	જૈન વણિક ભાવનગર, હાલ થાણા	(મો) ૭૫૦૬૧૦૪૭૭૭ (મો) ૯૮૬૭૮૦૮૭૨૭

લગ્નઈચ્છુક યુવક-યુવતીઓની યાદી યુવતી

નં	નામ, જ.તા., ઊંચાઈ, અભ્યાસ, વ્યવસાય	જ્ઞાતિ-મૂળ વતન-હાલ	સંપર્ક
૧)	કોમલ મુકુંદ ખેતાણી, ૨૨.૧૨.૧૯૯૧ ૫'૧', M.Com. Computer	જૈન વણિક ગોંડલ, હાલ ઘાટકોપર	(મો) ૯૮૬૭૧૭૯૮૭૧ (મો) ૯૮૬૭૮૦૮૭૨૭

ગરમા—ગરમ

‘ફાફડા ગાંઠીયા’ ઘરે બનાવીએ

સામગ્રી

- (૧) ચણાનો લોટ
- (૨) અજમો
- (૩) હિંગ
- (૪) મીઠું – નમક
- (૬) બેકિંગ સોડા
- (૫) શિંગ તેલ – મોણ માટે અને તળવા માટે.



સહુ પ્રથમ ચણાનો લોટ એક લોયા (કઢાઈ)માં લ્યો. અજમો અને હિંગને એક નાની વાટકીમાં લઈને થોડા પાણીમાં મિશ્રણ કરો. આવશ્યકતા અનુસાર થોડુંક મીઠું (નમક) અને બેકિંગ સોડા પાણીમાં ભેળવીને પણ આ મિશ્રણમાં ભેળવી દો. હવે મહત્વનું પાસું છે ચણાના લોટને બાંધવાનું. નમક, અજમો અને હિંગના

મિશ્રણ વાળુ પાણી ચણાના લોટમાં ભેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં ઉમેરતાં લોટ બાંધવો. થોડુંક તેલ મોણ તરીકે ઉમેરીને જાડો લોટ બાંધવો. બંધાયેલો બહુ નરમ ન થવો જોઈએ. હવે એક તવા અથવા લોયામાં બિન વપરાયેલું તેલ ચુલા પર મૂકીને હળવા આંચે તેલ મૂકવું. તેલ પુરતું ગરમ થયાં બાદ એક પાટલા પર લોટના નાના નાના લોયાંઓને હથેળીથી દબાવીને લાંબા કરીને, પાતળા ચપ્પુથી હળવેથી ઉપાડીને તળવા માટે તેલની કઢાઈમાં નાંખતા જાવ.

ઝારીથી હળવા આંચે ફાફડાને તળવા. યોગ્ય તળાઈ ગયાં બાદ મોટા થાળમાં ઉતારીને તેની ઉપર હિંગનો પાવડર અથવા જીરાણુ છાંટીને તળેલાં લીલા મરચાં તથા ખમણ—પપૈયાના સંભારા સાથે સ્વાદ ગરમા—ગરમ ફાફડાનો માણો.

INCREASE
STORAGE
CAPACITY
by 100%



KOMPRESS COMPACTORS

Kompress Product Range:

- Compactors
- Locker / Filing Cabinets
- Shelving Systems
- Multi-tier Racking
- AS/RS & Mini-Load Systems
- Pallet Trucks / Stackers
- Reach Trucks
- Pallet Racking
- Heavy Duty Mobile Racking
- Drive-In / Drive through Racking
- Pallet Shuttle
- Logistic Support
- Forklifts
- Order Picker
- FIFO / LIFO Racking

Kompress (India) Pvt. Ltd.

Godrej Coliseum, B Wing, Sion East, Mumbai 400022. India.

Tel: +9122 - 61740000 / 24090563 / 24078230 Fax: +9122 - 61740055 / 24096832

ISO 9001 : 2015 | ISO 14001 : 2015 | ISO 45001 : 2018 | ISO 50001 : 2018

www.kompressindia.com | Toll Free : 1800 2700 232



JIC BUSINESS WORLD
A JAIN JAGRUTI CENTRE INITIATIVE

JAIN JAGRUTI CENTRE CENTRAL BOARD JAIN JAGRUTI CENTRE CENTRAL BOARD CHARITABLE TRUST

launches



BUSINESS FINANCIAL ASSISTANCE

સાધર્મિક સ્વાવલંબી યોજના

કોરોના મહામારીના કારણે
જેઓના વ્યવસાય - રોજગારને
પ્રતિકૂળ અસર થઈ છે તેવા
સાધર્મિક પરિવારોને
આર્થિક રીતે પગભર કરવાનો
બ્રહ્મ પ્રયાસ



કોરોના સંક્રમણ કાળમાં

ઉપાર્જન કરતાં આપ્તજનને જો ગુમાવ્યા હોય

તો સાધર્મિક સ્વાવલંબી યોજનાનો લાભ લેશો